

વિભાગ : A

❖ નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો. (દરેકના એક ગુણ) (05)

(1) ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે?

(A) નફો (B) ઉત્પાદન (C) સંચાલન (D) વેચાણ

(2) નીચેના પૈકી કયા વીમામાં જાખમનું તત્વ વધુ સમાયેલું છે?

(A) જન્મથી (B) મૂડી રોકાણથી (C) સંચાલનથી (D) વાતચીતથી

(3) ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે?

(A) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (B) સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
(C) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (D) બેંક ઓફ ઇન્ડિયા

(4) અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય?

(A) સંદેશો (B) ઇ-મેલ (C) માહિતીસંચાર (D) ઇ-કોમર્સ

(5) કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલન એક જ હોય છે?

(A) સંયુક્ત સાહા (B) સરકારી કંપની (C) સહકારી મંડળી (D) વૈયક્તિક માલિકી

વિભાગ : B

❖ નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યોમાં લખો (દરેકના એક ગુણ) (05)

(6) વ્યસાય એટલે શું?

(7) વીમો એટલે શું?

(8) બેંકનો અર્થ આપો.

(9) માહિતી સંચારનો અર્થ આપો.

(10) કર્તા કોને કહે છે?

વિભાગ : C

❖ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. (દરેકના બે ગુણ) (10)

(11) ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું?

(12) વીમાના સિદ્ધાંતોની માત્ર ચાલી આપો.

(13) કેશ-કર્ડિટ એટલે શું?

(14) આઉટ સોર્સિંગનો અર્થ આપો.

(15) વૈયક્તિક માલિકીમાં નાલિકની અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનીકારક છે?

વિભાગ : D

❖ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. (15)

(16) વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો.

(17) વિશિષ્ટ વખાત એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો.

(18) ટૂંકનોંધ લખો: 1. કોલ મની, 2. કોર બેલેન્સિંગ, 3. RTGS

અથવા

ટ્રાવેલર્સ ચેકની સમજૂતી આપો.

(19) માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો.

અથવા

ઇ-કોમર્સના સફળ સમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો.

(20) વૈયક્તિક માલિકીની લાક્ષણિકતાઓ સમજાવો. (ગમે તે છ)

❖ નીચેના 30 થી 34 સુધીના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો.

(15)

- (21) ઘંઘાકીય જોખમ એટલે શું? ઘંઘાકીય જોખમ ઉદભવવાના કારણો સમજાવો.
- (22) બેંકના કાર્યો સમજાવો. અથવા બેંક ખાતાના પ્રકારો જણાવો.
- (23) હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો.

Master Guru Chirag Prajapati